

**હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, મુવાલીયા ફાર્મ, દાહોદ દ્વારા**  
**“સજીવ ખેતી” અંગેની એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો**  
**તા.૦૯.૧૦.૨૦૧૭**

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે “સ્ટ્રેન્ધનીંગ ઓફ એગ્રી. પોલીક્લીનીક ફોર ટ્રાયબલ ફાર્મસ એટ દાહોદ”ની યોજના અંતર્ગત તા. ૦૯.૧૦.૨૦૧૭ ના રોજ “સજીવ ખેતી” અંગેની એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ” યોજવામાં આવેલ હતો. કેન્દ્રીય તાલીમ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ચારી,વાકસીયા, નવાનગર, પાનમ ગામોના કુલ ૪૮ ખેડૂતભાઈઓ, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કર્મચારીઓએ ભાગ લીધો.

શ્રી આરીફ શેખ (રિસર્ચ એસોસીએટ) એ પધારેલ ખેડૂતભાઈઓ, કૃષિ વૈજ્ઞાનિકો, કર્મચારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ ખેડૂતભાઈઓ, કૃષિ વૈજ્ઞાનિકો, કર્મચારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ કૃષિ નિષ્ણાતો દ્વારા જુદા જુદા વિષયો પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખેડૂતોને માહિતી આપેલ.

ડૉ. એમ. એમ. પંડ્યા (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ સજીવ ખેતી દ્વારા પર્યાવરણ સુરક્ષા, ખેતીમાં સજીવ ખેતીના મૂળભૂત ઘટકો તેમજ સજીવ ખેતીનું પ્રમાણન અને તેના ધારાધોરણો, સેન્દ્રીય ખેતી સર્ટીફિકેશન પધ્ધતી અને સુધારેલી જાતોની પસંદગી વિશે વિસ્તૃત માહિતી આપેલ. ત્યારબાદ ડૉ. વિકાસ પાલી (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ ખેતીમાં વર્મિકમ્પોસ્ટ બનાવવાની તેમજ સેન્દ્રીય ખાતરની વિવિધ પધ્ધતિઓ વિશે, ડૉ. એસ. એ. ચૌહાણ (રિસર્ચ એસોસીએટ) દ્વારા સજીવ ખેતીમાં સંકલિત ખેતી વ્યવસ્થાપન, લીલા પડવાશનું મહત્વ, વિવિધ ખોળનો ઉપયોગ તેમજ જૈવિક પ્રવાહી ખાતર વિશે માહિતીગાર કર્યા. ડૉ. વાય. બી ચૌહાણ (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ સજીવ ખેતીમાં પાકમાં રોગ નિયંત્રણ વિશે, કેન્દ્ર ખાતે ચાલતી શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃત્તિઓ વિશે, એગ્રી. પોલીક્લીનીક યોજના વિશે માહિતીગાર કર્યા. શ્રી આરીફ શેખ (રિસર્ચ એસોસીએટ) એ સજીવ ખેતીમાં બિનરાસાયણિક જીવાત નિયંત્રણ વ્યવસ્થાપણ વિશે માહિતી આપી હતી.

ત્યાર બાદ ડૉ. વાય. બી. ચૌહાણ, ડૉ. એમ. એમ. પંડ્યા (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક), ડૉ. એસ. એ. ચૌહાણ (રિસર્ચ એસોસીએટ), એ પધારેલ ખેડૂતભાઈઓને હલકા ધાન્ય સંશોધન કેન્દ્રની મુલાકાત કરાવેલ. સદર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન ડૉ. વાય. બી ચૌહાણ, ડૉ. એમ. એમ. પંડ્યા, ડૉ. એસ. એ. ચૌહાણ, શ્રી આરીફ શેખ દ્વારા કરવામાં આવેલ હતું.

# ફોટોગ્રાફ



રજીસ્ટ્રેશન



શાબ્દિક સ્વાગત



દીપ પ્રાગટ્ય



સજીવ ખેતી દ્વારા પર્યાવરણ સુરક્ષા, ખેતીમાં સજીવ ખેતીના મૂળભૂત ઘટકો તેમજ સજીવ ખેતીનું પ્રમાણન અને તેના ધારાધોરણો, સેન્દ્રીય ખેતી સર્ટીફિકેશન પદ્ધતી અને સુધારેલી જાતોની પસંદગી વિશે માર્ગદર્શન આપતા વૈજ્ઞાનિક ડૉ. એમ. એમ. પંડ્યા



“ખેતીમાં વર્મિકમ્પોસ્ટ બનાવવાની તેમજ સેન્દ્રીય ખાતરની વિવિધ પદ્ધતિઓ વિશે” વિશે માહિતી આપતા વૈજ્ઞાનિક ડૉ. વિકાસ પાલી



“સજીવ ખેતીમાં સંકલિત ખેતી વ્યવસ્થાપન, લીલા પડવાશનું મહત્વ, વિવિધ ખોળનો, જૈવિક પ્રવાહી ખાતરના ઉપયોગ વિશે વ્યાખ્યાન આપતા વૈજ્ઞાનિક ડૉ. એસ. એ. ચૌહાણ



સજીવ ખેતીમાં પાકમાં રોગ નિયંત્રણ વિશે, કેન્દ્ર ખાતે ચાલતી શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃત્તિઓ વિશે, એગ્રી. પોલીક્લીનિક યોજના વિશે તેમજ પ્રત્યક્ષ ફેરોમેન ટ્રેપ વિશે માર્ગદર્શન આપતા વૈજ્ઞાનિક ડૉ. વાચ. બી. ચૌહાણ





હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર ની મુલાકાત લેતા ખેડૂત ભાઈઓ